

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રગતિશીલ ખેડૂતો માટે“તૃણ ધાન્ય(શ્રી અન્ન)
પાકોનું મહત્વ” પર ફિલ્ડ ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિશ્વમાં હાલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત બં. અ. કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએટ અને ઈ.એલ.પી.ના વિદ્યાર્થીઓ અને કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., મુવાલીયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ ખાતે તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૩ ના રોજ “મિલેટ્સ(શ્રી અન્ન) પાકોનું મહત્વ” વિષય પરનો ફિલ્ડ ડે માન. કુલપતિશ્રી, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લાના ૬૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને શરૂઆતમાં ડૉ. પી. એમ. પટેલ દ્વારા સર્વે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ અને મિલેટ્સ (શ્રી અન્ન) પાકોની અગત્યતા ખેડૂતભાઈઓ સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ ફિલ્ડ ડેનું આયોજન કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., દાહોદના યુનિટ વડા, ડૉ. આર. જી. મછારે રોજીંદા ભોજનમાં શ્રી અન્નની અગત્યતા વિશે વિસ્તૃત માહિત આપેલ. ડૉ. એન. જે. જાદવે ફિલ્ડ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું કે, આજે ભોજનની થાળીમાંથી ધીમે ધીમે લુપ્ત થઈ રહેલા શ્રી અન્ન પાકો પોષણની દ્રષ્ટીએ કેટલા ઉપયોગી છે તેટલા જ પર્યાવરણની જૈવ વિવિધતા જાળવવામાં પણ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ. વાય. એમ. શુક્લ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષે (કૃષિ) ખેડૂતોને શ્રી અન્નની જરૂરિયાત વિષે માહિતગાર કર્યા હતા અને તૃણ ધાન્ય પાકોમાં(શ્રી અન્ન) રહેલ કેલરી તેમજ વિટામિન્સ, ખનિજો અને એમિનો એસિડની મનુષ્યના સ્વાસ્થ્યમાં કેવીરીતે ફાયદાકારક છે તેની માહિતી આપેલ. તે ઉપરાંત ઈ.એલ.પી.ના વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં શ્રી અન્નની મહત્વતા ઉપર નાટક રજૂ કર્યું હતું. તદ્દુપરાંત એગ્રોનોમી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ અલગ-અલગ શ્રી અન્નપાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કોદરા, વરી, કાંગ અને બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર પ્રકાશ પાડ્યો હતો, જેથી ખેડૂતોમાં શ્રી અન્નની ખેતી તરફનો અભિગમ વધે અને તેઓ વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે. શ્રી અન્ન પાક જે વધુ પૌષ્ટિક મુલ્ય, વાતાવરણના પરિબળો સામે પ્રતિકારક શક્તિ અને ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે એમ સમજાવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા દાહોદના ઇતિહાસ, શ્રી અન્નમાંથી બનતી મૂલ્યવર્ધિત પેદાશો અને તેના ઉપયોગથી સ્વાસ્થ્ય પર થતા ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા, જેથી ખેડૂતો વધુ આર્થિક વળતર અને સ્વાસ્થ્યના લાભ મેળવી શકે. કાર્યક્રમના અંતે બધા ખેડૂતોને શ્રી અન્નના બિયારણની કીટ વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત શ્રી અન્નના વિવિધ જાતોના બિયારણ તથા શ્રી અન્નમાંથી બનતી મૂલ્યવર્ધિત પેદાશો અને પ્રોડક્ટનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ હતું. અંતે બપોરના ભોજનમાં શ્રી અન્નની વિવિધ વાનગીઓ જેવી કે નાગલીનો શીરો, બાજરાના રોટલા અને મોરૈયાના પાપડ વિગેરે પીરસવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ અને પરિણામલક્ષી બનાવવા

માટે ડૉ. વી. જી. પટેલ, ડૉ. પી. એમ. પટેલ, ડૉ. એ. પી. પટેલ, અને ડૉ. વી. ડી. ચૌધરીના દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવા એગ્રોનોમી વિભાગના અનુસ્નાતક અને ઇ.એલ.પી.ના વિદ્યાર્થીઓ, બી.એ.સી.એ., આ.કૃ.યુ., આણંદ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

ફિલ્ડ ડે કાર્યક્રમની ઝાંખી



